

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૬/૦૭/૨૦૧૬ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૨૩૮/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૮ કેસ કરી, ૧૯ વ્યક્તિઓને ઝડપી ૧૯૬ લીટર દેશી દારૂ, ૦૭ બોટલ ઈંગ્લીશ દારૂ અને ૧૯ બિયર ટીન કબજે કર્યા હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૨૩૯/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૮૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૦૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

અપહરણની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૨૪૦/૧૬

ગોમતીપુર : સ્નેહાબહેન રણજીભાઈ વાઘેલા (રહે.શેઠ કોઠાવાળા વોરાની ચાલી, ઝુલતા મીનારા પાસે, ગોમતીપુર) ને તા.૫/૭/૧૬ બપોરના ૨/૩૦ વાગ્યાના સુમારે આરોપી રાકેશભાઈ પ્રવિણભાઈ સુમેરા (રહે.અંબીકાનગર, નરોડા) ઘર નજીકથી લગ્ન કરવાની લાલચ આપી, લલચાવી ફોસલાવી જારકર્મ કરવાના ઇરાદે ભગાડી લઈ ગયો છે. આ અંગેની ફરીયાદ સ્નેહાબહેનની માતા કવીતાબહેન વાઘેલાએ ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી એ.આર.જનકાન્ત ચલાવે છે.

સેટેલાઈટ : હિમ્મતભાઈ હવસિંહભાઈ હઠીલા (રહે.બચુભાઈનાં મકાનમાં, રાજીવનગર, સેટેલાઈટ) એ સેટેલાઈટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૪/૭/૧૬ સાંજના ૫/૦૦ વાગ્યાના સુમારે ઘર નજીકથી પોતાની પુત્રી મીના (ઉ.વ.૧૪) ને કોઈ અજાણી વ્યક્તિ અપહરણ કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી એમ.યુ.મશી ચલાવે છે.

દુષ્પ્રેરણની ફરીયાદ :-

સમાચાર યાદી નં.૧૨૪૧/૧૬

રામોલ : શ્વેતાબહેન વિમલભાઈ તિવારી (ઉ.વ.૨૧)(રહે.સંતદેવ સોસાયટી, જામફળવાડી, રામોલ) સાથે આરોપી દિવાકર મિશ્રા (રહે.ઓમ શાંતીનગર, વટવા) એ પ્રેમ સંબંધ બાંધી શ્વેતાબહેન પાસેથી સોનાની ચેઇન અને રોકડ રૂપિયા ૫૦,૦૦૦/- મેળવી, પરત નહીં આપી, શ્વેતાબહેન તથા તેમનાં પિતા અને ભાઈ સાથે ઝઘડો તકરાર કરતાં, શ્વેતાબહેનને મનમાં લાગી આવતાં, તા.૩/૭/૧૬ સવારનાં ૭/૦૦ વાગ્યા પહેલાં કોઈપણ સમયે પોતાના ઘરે પંખાનાં હુકમાં દુપટ્ટે બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગેની ફરીયાદ મરણ જનાર શ્વેતાબહેનનાં ભાઈ નીતીષ તિવારીએ તા.૫/૭/૧૬ નારોજ રામોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી પી.ડી.સોલંકી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.